



AE-1224

Seat No. _____

First Year B. A. (Non CBCS) Examination

February – 2016

Economics : Paper - I

(Principles of Economics) (Optional-I) (New Course)

Time : 3 Hours]

[Total Marks : 100

- સૂચના : (૧) દરેક પ્રશ્નના ગુણ સરખા છે.
(૨) જરૂર જણાય ત્યાં આકૃતિ દોરો.
(૩) આંતરિક વિકલ્પના આધારે બધા પ્રશ્નોના ઉત્તર આપો.

- ૧ પ્રો. રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યાની ટીકાત્મક ચર્ચા કરો. ૨૦
અથવા
૧ (અ) અર્થશાસ્ત્રના નિયમોનું મહત્ત્વ સ્પષ્ટ કરો. ૧૦
(બ) સ્થિર અર્થશાસ્ત્ર અને ગતિશીલ અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત દર્શાવો. ૧૦
- ૨ અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સમજાવો. ૨૦
અથવા
૨ નીચેનામાંથી કોઈ પણ બે ખ્યાલો સમજાવો : ૨૦
(૧) સંપત્તિ
(૨) પુરવઠો
(૩) મૂલ્ય અને કિંમત
(૪) માનવ જરૂરિયાતો.
- ૩ ઘટતા મળતરનો નિયમ ઉદાહરણ અને આકૃતિની મદદથી સમજાવો. ૨૦
અથવા
૩ ભાડાનો રીકાર્ડોનો સિદ્ધાંત વિગતે સમજાવો. ૨૦
- ૪ વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજાવી તેની મર્યાદાઓ દર્શાવો. ૨૦
અથવા
૪ (અ) વ્યાજના દરને અસર કરતાં પરિબળો સમજાવો. ૧૦
(બ) ‘નફો એ નવપ્રવર્તનનું પરિણામ છે.’ - ચર્ચા કરો. ૧૦

૫	ટૂંક નોંધ લખો :	૨૦
	(૧) આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ	
	(૨) વાસ્તવિક વેતનને અસર કરતાં પરિબલો	
	(૩) એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર	
	(૪) કાયો નફો અને ચોખ્ખો નફો.	

ENGLISH VERSION

- Instructions :** (1) All questions carry equal marks.
(2) Draw diagrams wherever necessary.
(3) Answer all questions on the basis of internal option.

- | | | |
|---|---|----|
| 1 | Examine critically the definition of economics as given by Prof. Robbins. | 20 |
|---|---|----|

OR

- | | | |
|---|---|----|
| 1 | (a) Clarify the importance of the law of Economics. | 10 |
| | (b) Distinguish between the Static Economics and the Dynamic Economics. | 10 |

- | | | |
|---|--|----|
| 2 | Explain the nature and scope of Economics. | 20 |
|---|--|----|

OR

- | | | |
|---|--------------------------------------|----|
| 2 | Explain any two concept from below : | 20 |
| | (1) Wealth | |
| | (2) Supply | |
| | (3) Value and price | |
| | (4) Human wants. | |

- | | | |
|---|---|----|
| 3 | Explain the law of diminishing returns with the help of illustration and a diagram. | 20 |
|---|---|----|

OR

- | | | |
|---|---|----|
| 3 | Explain the principle of Rent of Ricardo in detail. | 20 |
|---|---|----|

- 4 Explain the marginal productivity theory of distribution and point out its limitations. **20**

OR

- 4 (a) Discuss the factors effecting interest rate. **10**
(b) 'Profit is a reward of innovation.' Explain it. **10**
- 5 Write short notes : (any **two**) **20**
- (1) Economic activity and non economic activity
 - (2) The factors affecting on real wage
 - (3) Micro economics and macro economics
 - (4) Gross profit and Net Profit.
-